

ખેડૂત ઉપયોગી સંશોધન ભલામણો

વર્ષ : ૨૦૧૫



ગુજરાત જૂનાગઢ ચાણા-૬



ગુજરાત જૂનાગઢ તુવેર-૧



ગુજરાત જૂનાગઢ તલક-૫



ગુજરાત લાંબા રીંગણા-૧



જૂનાગઢ હાઇબ્રિડ રીંગણા-૪



ગુજરાત જૂનાગઢ સંક્રિયા-૪



ગુજરાત જૂનાગઢ ગલકા-૨



ગુજરાત જૂનાગઢ લાલ કુંગળી-૧૧

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ



ટ્રપક પદ્ધતિ



ફોસ્ફરસ + સુક્રમ જીવાયુની માવજાત



ગુજરાત જૂનાગઢ
લાલ કુંગળી - ૧૧



સાંકણી યાખી અને
ગાલ્વમાણની થિયન્સ નિયંત્રણ

ખેડૂત ઉપયોગી સંશોધન ભલામણો

વર્ષ - ૨૦૧૫

-:: સંકલન ::-

ડૉ. એ.એમ. પારખીયા
ડૉ. જી.આર. ગોહિલ
પ્રો. વી.જી. બારડ



સરદાર સ્મૃતિ કેન્દ્ર
વિસ્તરણ શિક્ષણ નિયામકશીની કચેરી
જૂનાગઢ કૃષ્ણ યુનિવર્સિટી, જૂનાગઢ



ખેડૂત ઉપયોગી ભલામણો: વર્ષ - ૨૦૧૫

પ્રકાશન વર્ષ : ૨૦૧૫-૧૬

કૃષિ વિસ્તરણ શિક્ષણ પ્રકાશન શ્રેણી : ૩-૧-૭૭

નકલ : ૫૦૦

પ્રકાશક :

વિસ્તરણ શિક્ષણ નિયામકશીની કચેરી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ

મુદ્રક :

મેટ્રો ઓફસેટ

દોલતપરા, જૂનાગઢ

ફોન (૦૨૮૫) ૨૬૬૧૨૫૪



ડૉ. એ.આર.પાઠક

કુલપતિશ્રી,
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,
જૂનાગઢ-૩૬૨૦૦૧
ફોન: ઓ: ૦૨૮૪-૨૬૭૧૭૮૪
ફેક્સ નં.: ૦૨૮૪-૨૬૭૨૦૦૪
Email: vc@jau.in
તા. ૧૯/૧૧/૨૦૧૫

શુભેચ્છા સંદેશ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ૨૦૦૪ થી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતી અને તેની સંલગ્ન ક્ષેત્રો સાથે સંકળાયેલા ખેડૂત મિત્રોની દિન-પ્રતિદિન બદલાતી જતી જરૂરીયાતોને ધ્યાનમાં રાખી તેઓને તેમના વ્યવસાયમાં ઉપયોગી થાય તેવા સંશોધનો હાથ ધરવાની જવાબદારી સંભાળેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તેના વિવિધ સંશોધન કેન્દ્રો દ્વારા સંશોધન અખતરાઓ ગોઠવી વિવિધ સંશોધનો હાથ ધરે છે. ત્રણ-ચાર વર્ષ સુધી ચાલેલા અખતરાઓના સફળ પરિણામોને અલગ તારવી તેની સમીક્ષા સંશોધનની પેટા સમિતિમાં કરવામાં આવે છે. ત્યારબાદ સંશોધનની સંયુક્ત બેઠકમાં આ ભલામણો મંજૂર કરવા રજૂ કરવામાં આવે છે.

રાજ્યની કૃષિ યુનિવર્સિટીની સંશોધન પરિષદની અગ્નિયારમી બેઠકમાં ૨૦૧૫ના વર્ષમાં જે ભલામણો મંજૂર કરેલ છે. એ ખેડૂતો તેમજ વિસ્તરણ કાર્યકરો સમજી શકે તેવી રીતે સંકલિત કરી પ્રકાશિત કરવાનો પ્રયાસ કરવા બદલ ડૉ. એ.એમ. પારખીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશી તેમજ ડૉ. જી.આર. ગોહિલ અને પ્રો. વી.જી. બારડને અભિનંદન પાઠવું છું.

આ પુસ્તિકામાં સમાવિષ્ટ ભલામણો બદલાતા સમયની માંગને ધ્યાનમાં રાખી કરેલ સંશોધનોના ફળ સ્વરૂપે હોઈ, ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે ફાયદાકારક તેમજ વિસ્તરણ કાર્યકરો માટે માર્ગદર્શક બની રહેશે તેવી મને આશા છે.

(એ.આર. પાઠક)



ડૉ. એ. એમ. પારખીયા

વિસ્તરણ શિક્ષણ નિયામક
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
ફોન: ઓ: ૦૨૮૫-૨૬૭૨૬૫૫
ફેક્સ નં.: ૦૨૮૫-૨૬૭૧૬૬૮
Email: dee@jau.in
તા. ૧૬/૧૧/૨૦૧૫

શુભેચ્છા સંદેશ

રાજ્યના જુદા જુદા ખેત હવામાન વિભાગ પૈકી ઉત્તર અને દક્ષિણ સૌરાષ્ટ્ર તથા ઉત્તર-પશ્ચિમ ગુજરાત ખેત હવામાનના કેટલાક ભાગ મુજબ કૃષિ સંશોધનો હાથ ધરવાની જવાબદારી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ઉપાડેલ છે. વર્ષ - ૨૦૧૫ ની સંશોધનની અગિયારમી પરિષદની સંયુક્ત બેઠકમાં કુલ - ૫૩ સંશોધન ભલામણો મંજૂર કરવામાં આવેલ છે. આ ખેડૂત ઉપ્યોગી સંશોધન ભલામણોનું સંક્ષિપ્ત સંકલન કરી વિસ્તરણ કાર્યકરો અને ખેડૂતો સમજી શકે તેવી સરળ ભાષામાં તૈયાર કરી "ખેડૂત ઉપ્યોગી સંશોધન ભલામણો" પુસ્તિકારૂપે પ્રકાશિત કરવાનો નામ પ્રયાસ કર્યો છે. આ પુસ્તિકા માટે જરૂરી માહિતી લાગતા-વળગતા સંશોધન વૈજ્ઞાનિકશ્રીઓ, સંશોધન પરિષદની પેટા સમિતિઓના કન્વીનરશ્રીઓ તેમજ સંશોધન નિયામકશ્રી પાસેથી મેળવેલ છે.

આ પુસ્તિકામાં સમાવિષ્ટ સંશોધન ભલામણો તાજેતરમાં થયેલ સંશોધનોના ફળ સ્વરૂપે હોય, ખેડૂતોને અને વિસ્તરણ કાર્યકરોમાં જરૂર માર્ગદર્શક બની રહેશે.

આ પુસ્તિકામાં આપવામાં આવેલ માહિતીનું વ્યવસ્થિત સંકલન કરી તૈયાર કરવામાં વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીના ડૉ. જી.આર. ગોહિલ અને પ્રો. વી. જી. બારડાએ પ્રશંસનીય કામગીરી કરેલ છે તેને મારા ઘન્યવાદ.

સંદેશ
(એ.એમ. પારખીયા)

અનુક્રમણિકા

ક્રમ	પાકનું નામ	પાના નં.
૧.	વિવિધ પાકોની સુધારેલી / સંકર જાતો	૧
૨.	ધાન્ય પાકો	૫
૩.	તેલીબિયાં પાકો	૭
૪.	કઠોળ પાકો	૧૦
૫.	રોકડીયા પાકો	૧૧
૬.	શાકભાજીના પાકો	૧૨
૭.	મસાલા પાકો	૧૩
૮.	બાગાયતી પાકો	૧૪
૯.	કૃષિ ઈજનેરી	૧૬
૧૦.	મત્સ્ય પાલન	૧૮
૧૧.	અન્ય	૧૯



ખેડૂત ઉપયોગી સંશોધન ભલામણો - ૨૦૧૫

૧) વિવિધ પાકોની સુધારેલી/સંકર જાતોની માહિતી

૧.૧ ચણાની નવી જાત ગુજરાત જૂનાગઢ ચણા ૬

ગુજરાતમાં બિનપિયત પરિસ્થિતિ હેઠળ ચણા ઉગાડતા ખેડૂતોને ગુજરાત જૂનાગઢ ચણા ૬ જાતનું વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે. આ જાતે (૧૮૬૭ ક્ર./હે.) નિયંત્રણ હેઠળની જાતો જેવી કે ગુજરાત ચણા ૧ (૧૬૪૩ ક્ર./હે.), ગુજરાત ચણા ૨ (૧૫૩૧ ક્ર./હે.) અને ગુજરાત જૂનાગઢ ચણા ૩ (૧૭૭૫ ક્ર./હે.) કરતા અનુકૂળે ૧૩.૬, ૨૧.૬ અને ૫.૨ ટકા વધુ દાણાનું ઉત્પાદન આપેલ છે. આ જાતના દાણાં મધ્યમ કદના અને ધારા કથ્યાઈ રંગના અને ૧૮.૮ ટકા પ્રોટીન ઘરાવે છે. આ જાત સુકારા (૮.૭%) તથા સ્ટન્ટના રોગ (૫.૦%) સામે પ્રતિકારક શક્તિ ઘરાવે છે.

(સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (ચણા) કઠોળ સંશોધન કેન્દ્ર, જૃકૃયુ, જૂનાગઢ)

૧.૨ તુવેરની નવી જાત ગુજરાત જૂનાગઢ તુવેર ૧

ગુજરાત રાજ્યના તુવેર ઉગાડતા ખેડૂતોને ગુજરાત જૂનાગઢ તુવેર ૧ (જી.જે.પી.-૧) જાતનું વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે. આ જાતે (૨૧૧૫, ૨૦૪૫ અને ૧૮૮૭ ક્ર./હે.) નિયંત્રણ હેઠળની જાતો જેવીકે બી.ડી.એન. ૨ (૧૫૨૪ ક્ર./હે.), આઈ.સી.પી.એલ. ૮૭૧૧૮ (૧૮૫૮ ક્ર./હે.) અને વૈશાલી (૧૫૫૭ ક્ર./હે.) કરતા અનુકૂળે ૩૮.૭૮, ૧૦.૦૫ અને ૨૭.૫૨ ટકા વધુ ઉત્પાદન આપેલ છે. આ મધ્યમ મોડી પાકતી (૧૭૬ દિવસ) જાત છે. જી.જે.પી. ૧ જાત સુકારા (૧૩.૮૮%) અને વંધત્વના રોગ (૧૩.૮૮ %) સામે સારી પ્રતિકારકતા ઘરાવે છે. આ જાતના દાણા મોટા કદના અને સંક્રિયા રંગના છે.

(સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (ચણા) કઠોળ સંશોધન કેન્દ્ર, જૃકૃયુ, જૂનાગઢ)

૧.૩ જૂનાગઢ હાઈબ્રીડ રીગણ ૪ (જીજે -બી-ઓચ-૪)

ગુજરાત રાજ્યમાં મોડી ખરીફ ઋતુ (૧૫ ઓગષ્ટ થી ૧૫ સપ્ટેમ્બર) માં

હાઈબ્રિડ રીગણ ઉગાડવામાં રસ ધરાવતા ખેડૂતોને રીગણની ગુજરાત જૂનાગઢ હાઈબ્રિડ રીગણ—૪ (જીજેબીએચ—૪) જાતની વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતના રીગણનું ઉત્પાદન ૪૨૮.૦૧ કવીન્ટલ/હેકટર મળેલ, જે નિયંત્રિત જાત ગુજરાત સંકર રીગણ—૨ (૩૭૫.૦૮ કવીન્ટલ/હેકટર) તથા આણંદ સંકર રીગણ—૧ (૩૪૦.૫૭ કવીન્ટલ/હેકટર) કરતા અનુક્રમે ૧૪.૧૧તથા ૨૫.૬૮ ટકા વધારે માલુમ પડેલ. આ જાતનું પ્રાઈવેટ હાઈબ્રિડ જાતો નવીના (વીએનઆર સીડસ) અને એઆરબીએચ—૨૦૧ (અંકુર સીડસ) કરતા અનુક્રમે ૬.૬૫ અને ૭.૬૬ ટકા વધારે ઉત્પાદન માલુમ પડેલ. આ હાઈબ્રિડમાં તડતડીયા (૨.૮૪/પાન), સફેદ માખી (૩.૬૭/પાન) અને ફળ કોરી ખાનારી ઈયળ (૪.૮૩ %) અંકુશ જાતો કરતા ઉપદ્રવ ઓછો જોવા મળેલ. પ્રોટીન (૧.૪૮ %) અને કુલ દ્રાવ્ય સર્કરા (૩.૩૩ %) અંકુશ જાતો કરતા વધારે હતું. આ જાતના રીગણના ફળો મધ્યમ કદના, લંબગોળ તથા જાંબલી ગુલાબી રંગના સારા ચણકાટવાળા થાય છે.

(સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (લ-ઠું), શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

૧.૪ ગુજરાત લાંબા રીગણ ૧

ગુજરાત રાજ્યમાં મોડી ખરીફ ઝસ્તુ (૧૫ ઓગસ્ટ થી ૧૫ સપ્ટેમ્બર) રીગણનો પાક ઉગાડતા ખેડૂતોને રીગણની ગુજરાત જૂનાગઢ લાંબા રીગણ—૪ (જીજેઅલબી—૪) જાતની વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતના રીગણનું ઉત્પાદન ૩૮૬.૦૩ કવીન્ટલ/હેકટર મળેલ, જે નિયંત્રિત જાત ગુજરાત લંબગોળ રીગણ—૧ (૩૦૨.૭૫ કવીન્ટલ/હેકટર) તથા ગુજરાત લાંબા રીગણ—૧ (૩૧૪.૭૩ કવીન્ટલ/હેકટર) કરતા અનુક્રમે ૩૦.૮૧ તથા ૨૫.૮૩ ટકા વધારે માલુમ પડેલ. લધુપર્ણ (૫.૦૮ %) નો રોગ અંકુશ જાત ગુજરાત લંબગોળ રીગણ—૧ (૬.૧૫ %) કરતા ઓછો માલુમ પડેલ. તડતડીયા (૩.૦૪ %), સફેદમાખી (૪.૭૦ %) અને ફળ કોરી ખાનારી ઈયળ (૧૧.૦૫ %) નો ઉપદ્રવ અંકુશ જાતો કરતા ઓછો માલુમ પડેલ. આ જાતમાં પ્રોટીન (૧.૫૧ %) તથા કુલ દ્રાવ્ય સર્કરા (૩.૩૬ %) જે અંકુશ જાતો કરતા વધારે જોવા મળેલ. આ જાતના રીગણના ફળો મધ્યમ કદના, લાંબા તથા આછા જાંબલી રંગના સારા ચણકાટવાળા છે.

(સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (લ-ઠું), શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

૧.૫ ગુજરાત જૂનાગઢ સંકર ભીડા ૪ (જીજે-ઓચેચ-૪)

ગુજરાતમાં ચોમાસુ ઋતુમાં ભીડાનો પાક ઉગાડતા ખેડૂતોને ભીડાની ગુજરાત જૂનાગઢ સંકર ભીડા-૪ (જીજેઓચેચ-૪) જાતનું વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે. આ સંકર જાતના ભીડાનું ઉત્પાદન ૧૩૫.૮૪ કવીન્ટલ/હેક્ટર મળેલ, જે અંકુશ જાત પુસા સાવની કરતા ૪૬.૯૧ ટકા વધારે માલૂમ પડેલ. જ્યારે આ સંકર જાતે અંકુશ સંકર જાત ગુજરાત જૂનાગઢ સંકર ભીડા-૩ ની સરખામણીએ ૧૪૫.૭૪ કવીન્ટલ/હેક્ટર ભીડાનું ઉત્પાદન આપેલ, જે ૨૩.૮૬ ટકા વધારે માલૂમ પડેલ. આ સંકર જાતમાં પીળી નસ નો રોગ (૩૫.૭૧ %) અંકુશ સંકર જાતો ગુજરાત જૂનાગઢ સંકર ભીડા-૨ (૪૬.૧૫ %) કરતા ઓછો માલૂમ પડેલ. તડતડીયા (૫.૨૮/પાન), શ્રીષ્ટિ (૪.૭૮/પાન), સફેદ માખી (૪.૭૮/પાન) તથા ફળ ખાનારી ઈયળ (૪.૬૬ %) અંકુશ જાતો કરતા ઓછી હતી. આ હાઈશ્રીડ જાતના ભીડા મધ્યમ, ઘેરા લીલા રંગનાં, કુણા, લાંબા અને આકર્ષક થાય છે.

(સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (લ-૩), શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ)

૧.૬ ગુજરાત જૂનાગઢ ગલકાં ૨ (જીજે-એસજી-૨)

સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં ચોમાસુ ઋતુમાં ગલકાનો પાક ઉગાડતા ખેડૂતોને ગુજરાત જૂનાગઢ ગલકા-૨ (જીજેએસજી-૨) જાતનું વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતના ગલકાનું ઉત્પાદન ૧૧૪.૦૪ કવીન્ટલ/હેક્ટર મળેલ, જે નિયંત્રિત જાત ગુજરાત ગલકા-૧ (૮૬.૫૦ કવીન્ટલ/હેક્ટર) તથા રાષ્ટ્રીય જાત પુસા ચીકની (૮૫.૫૮ કવીન્ટલ/હેક્ટર) કરતા અનુક્રમે ૧૮.૦૫ તથા ૧૮.૧૮ ટકા વધારે માલૂમ પડેલ. આ જાતમાં પંચરંગીયો (૧૮.૨૫ %), ફળમાખી (૧૨.૮૮ %) અને પાન વાળનારી ઈયળ (૫.૬૧ %) નું નુકશાન અંકુશ જાતો કરતા ઓછું જણાયેલ હતું. આ જાતમાં માવા/ધાલનું પ્રમાણ (૧૨.૩૮૩ %), કુલ દ્રાવ્ય ઘનપદાર્થ (૫.૨૫ %), કુલ દ્રાવ્ય સર્કરા (૧.૬૭ %) અને પ્રોટીન (૦.૨૧૮ %) છે જે અંકુશ જાતો કરતા વધારે જોવા મળેલ. આ જાતના ગલકાના ફળો લાંબા, લીલા રંગના તથા ચળકાટવાળા થાય છે.

(સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (લ-૩), શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ)

૧.૭ ગુજરાત જૂનાગઢ લાલ કુંગળી -૧૧ (જીજે-આરઓ-૧૧)

ગુજરાત રાજ્ય (દક્ષિણ ગુજરાત સીવાય) માં રવિ ઋતુમાં કુંગળીનો પાક ઉગાડતા ખેડૂતોને કુંગળીની ગુજરાત જૂનાગઢ લાલ કુંગળી-૧૧ (જીજેઆરઓ-૧૧) જાતની વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતના કંદનું ઉત્પાદન ૨૨૩.૫૫ કવીન્ટલ/હેકટર મળેલ, જે નિયંત્રિત જાત એશ્રી ફાઉન્ડ લાઈટ રેડ (૨૬૬.૧૫ કવીન્ટલ/હેકટર), પીળીપત્તી (૨૭૨.૫૫ કવીન્ટલ/હેકટર) તથા તળાજા લાલ (૨૮૦.૩૪ કવીન્ટલ/હેકટર) કરતા અનુકૂમે ૨૧.૫૭, ૧૮.૭૧ તથા ૧૫.૪૧ ટકા વધારે માલુમ પડેલ. જાંબલી ધાખાનો રોગ (૧૨.૬૭ %) અંકુશ જાતો એશ્રીફાઉન્ડ લાઈટ-લાલ (૨૦.૩૦ %), પીળીપત્તી (૨૩.૫૬ %) તથા તળાજા લાલ (૨૪.૨૮ %) કરતા ઓછો માલુમ પડેલ. શ્રીપસ (૫.૭/પાન) ઓછા જોવા મળેલ. આ જાત અંકુશ જાતો એશ્રીફાઉન્ડ લાઈટ-લાલ તથા તળાજા લાલ કરતા ઓછી તીખી છે. આ જાતમાં ૧૨.૮૪ ટકા કુલ દ્રાવ્ય ધન પદાર્થ છે. આ જાતના કંદ મધ્યમ કદના, ગોળ ચપટા તથા લાલ રંગના થાય છે.

(સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (લ-કુ), શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જૂનાગઢ)

૧.૮ ગુજરાત જુનાગઢ તલ ૫ (જીજેટી ૫)

તલની આ જાત ઉનાળું વાવેતર માટે અમરેલી કેન્દ્ર પરથી વિકસાવવામાં આવેલ છે. આ જાતનું ઉત્પાદન ૧૨૪૧ કિ.ગ્રા./હે. મળેલ છે, જે અંકુશ જાત ગુજરાત તલ ૩ (૧૦૧૪ કિ.ગ્રા./હે.) કરતા ૨૨.૭૮ ટકા વધારે માલુમ પડેલ છે. તથા તેનું પ્રતિ હેકટર તેલ ઉત્પાદન ગુજરાત તલ ૩ જાત કરતા ૨૨.૨૨ ટકા વધારે જોવા મળેલ છે. આ જાત ૮૧ દિવસમાં પાકે છે તથા દાણા મોટા અને સફેદ રંગના હોવાથી નિકાસ માટે અનુકૂળ છે. દાણામાં તેલનું પ્રમાણ ૪૬.૮૮ ટકા છે. આ જાતના પાન મુખ્ય થડ પર સામસામે ગોઠવાયેલ હોય છે તથા પાનના કક્ષામાં એક કરતા વધુ સંખ્યામાં બૈઢા રૂવાટી વગરના આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિક (પાક સંવર્ધન), કૃષિ સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, અમરેલી)

૨) ધાન્ય પાકો

૨.૧ બાજરી

(ક) બાજરી પાકમાં છાણિયા ખાતરનું વ્યવસ્થાપન

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં બાજરી – ચણા પાક પદ્ધતિ અપનાવતા અને સેન્દ્રીય ખેતીમાં રસ ધરાવતા ખેડૂતોને વધુ નફો મેળવવા તેમજ જભીનની ફળદુપતા જાળવવા દર વર્ષે ફક્ત બાજરાના પાકમાં છાણિયું ખાતર ૭.૫ ટન/હેક્ટાર પ્રમાણે આપવાની ભલામણ કરવામાં આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (બાજરા) બાજરા સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જામનગર)

(ખ) બાજરી પાકમાં રાસાયણિક ખાતરનું વ્યવસ્થાપન

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં સંકર બાજરી ઉગાડતાં ખેડૂતોને વધુ ઉત્પાદન અને નફો મેળવવા પ્રતિ હેક્ટાર ૧૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૩૦ કિ.ગ્રા. ફોર્ઝરસ આપવાની ભલામણ કરવામાં આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (બાજરા) બાજરા સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જામનગર)

(ગ) બાજરીના પાકમાં પોષણ વ્યવસ્થા

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં સંકર બાજરી ઉગાડતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે બાજરીનું મહત્તમ ઉત્પાદન, ચોખ્યુ વળતર અને દાણાની ગુણવત્તા સુધારવા માટે ભલામણ કરેલ રાસાયણિક ખાતર (૮૦-૪૦-૦ કિ.ગ્રા. ના.-ફો.-પો./હે.) અને ૫ ટન/હે. છાણિયા ખાતર સાથે જીકિ સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ દરેક ૨૦ કિ.ગ્રા./હે. આપવું.

(સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (બાજરા) બાજરા સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જામનગર)

(ધ) બાજરીમાં સાંઠાની માખી અને ગાભ મારાની દ્યયળનું અસરકારક નિયંત્રણ

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસુ બાજરી ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, સાંઠાની માખી અને ગાભમારાની

ઈયળના અસરકારક નિયંત્રણ માટે બાજરીના બીજને વાવેતર વખતે ઈમિડાકલોપ્રિડ ૫૦૦ એફએસ ૮.૭૫ મિલિ/ક્રિ.ગ્રા. બીજ, ૪.૨ ગ્રામ સ.ત./ક્રિ.ગ્રા. નો ૫૮ આપવો તેમજ પાકના ઉગાવા બાદ ૩૫ દિવસે ઈમિડાકલોપ્રિડ ૧૭.૮ એસએલ, ૦.૦૦૮% (૫.૦ મિલિ/૧૦ લિટર પાણી, ૪૫.૮૮ ગ્રામ સ.ત. / હેક્ટર) નો છંટકાવ કરવો. આ દવાના છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચે ૪૨ દિવસનો સમય ગાળો જાળવવો.

(સંશોધન વૈજ્ઞાનિકશ્રી, (બાજરા) બાજરા સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જામનગર)

૨.૨ ઘઉ

(ક) ઘઉના પાકમાં દિવેલની માવજતથી સંગ્રહ શક્તિ વધારવી

ઘઉ સંગ્રહ કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, કમ્બાઈન્ડ હાર્વેસ્ટર દ્વારા કાપણી કરી તૈયાર થતા ઘઉ (૫% સુધી યંત્ર દ્વારા નુકસાન પામેલ દાણા) ને કોઈપણ જાતની માવજત વિના શરીનાં કોથળામાં સંગ્રહ કરવાને બદલે દિવેલની (૧૫ મિ.લિ./ક્રિ.ગ્રા.) માવજત આપી ગેલેવેનાઈડ પીપમાં સંગ્રહ કરવામાં આવે તો સંગ્રહ દરમ્યાન નુકસાન કરતી જીવાત આંધળા જીવડા, તેનાથી થતું દાણાનું નુકસાન તથા વજનમાં થતો ઘટાડો ઓછો જોવા મળે છે અને ૮ માસ સુધી સંગ્રહ કરી શકાય છે.

(પ્રાધ્યાપક અને વડા, પ્રોસેસીંગ અને ફૂડ એન્જીયરીંગ વિભાગ, ફૂઝિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂક્કુયુ, જૂનાગઢ)

(ખ) ઘઉના પાકમાં વૃદ્ધિ વર્ધકનો છંટકાવ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાડિય વિસ્તારમાં પિયત ઘઉનું વાવેતર કરતા ખેડૂતોને વધારે ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે ઘઉમાં દૂધિયા દાણાની અવસ્થાએ ૦.૦૧ મિલીગ્રામ/લિટર ૦.૦૪% w/w (૧૨.૫ મિલી લિટર બ્રાસિનોલાઈડ લઈ ૫ લિટર પાણીમાં ઓગાળી, તેમાંથી ૧૫૦ મિલીલિટર લઈ ૧૫ લિટર દ્વારા બનાવવું) વૃદ્ધિ વર્ધક બ્રાસિનોલાઈડનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

(પ્રાધ્યાપક અને વડા, જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

૩. તેલીબિયાં પાકો

૩.૧ મગફળી

(ક) મગફળીમાં આંતરખેડ દ્વારા મહિતમ ઉત્પાદન

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં વરસાદ આધારીત મગફળીનું વાવેતર કરતાં ખેડૂતોને મગફળીનું મહિતમ ઉત્પાદન, ચોખ્યુ વળતર તેમજ અસરકારક ભેજ સંગ્રહ તથા નીદણ નિયંત્રણ માટે વાવણી પહેલાં હારમાં સબસોઈલીગ (૨૦ સે.મી. ની ઉડાઈએ) તથા ૧૫, ૩૦, ૪૫ અને ૬૦ દિવસે આંતરખેડ કરવાની તેમજ વાવણી બાદ પરંતુ પાક અને નીદણ ઉગ્યા પહેલાં પેન્ડીમેથાલીન ૮૦૦ ગ્રા./હે. (૩૦ ઈસી ૬૦ મિ.લિ/૧૦ લિ.) પ્રમાણે છંટકાવ કરવાની તથા વાવણી બાદ ૩૦ અને ૪૫ દિવસે હાથ નિંદામણ કરવાની ભલામણ કરવામાં આવે છે.

(પ્રાધ્યાપક અને વડા, કૃષિ વિજ્ઞાન વિભાગ, જૂક્યુ, જૂનાગઢ)

(ખ) ઉનાળું મગફળીના પાકમાં ખાતર વ્યવસ્થાપન

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ઉનાળું મગફળી ઉગાડતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે મગફળીમાં પ્રતિ હેકટરે ૭.૫ ટન છાણીયું ખાતર અને ભલામણ કરેલ રાસાયણિક ખાતરના ૫૦ % (એટલે કે ૧૫–૩૦ કિ.ના.–ફો./હે.) જથ્થો આપવાથી વધુ ઉત્પાદન અને નફો મળે છે.

(સંશોધન વૈજ્ઞાનિક (મગફળી) મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

(ગ) મગફળી અને કપાસની આંતરપાક પદ્ધતિમાં ખાતર વ્યવસ્થા

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં મગફળી અને કપાસની આંતરપાક પદ્ધતિ (૩:૧ ના પ્રમાણમાં) અપનાવતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે મગફળીના પાકને ભલામણ કરવામાં આવેલ ખાતરનો ૫૦ ટકા જથ્થો (એટલે કે ૬.૨૫–૧૨.૫–૦ ના–ફો–પો કિ.ગ્રા./હે) અને કપાસના પાકને ભલામણ કરેલ ખાતરનો ૧૦૦ ટકા જથ્થો (એટલે કે ૧૫૦ નાઈટ્રોજન કિ.ગ્રા./હે) આપવાથી વધારે ઉત્પાદન અને નફો મળે છે.

(સંશોધન વૈજ્ઞાનિક (મગફળી) મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

(ઘ) મગફળીપાકમાં ટ્રાયકોડમની માવજત

ઉત્તર અને દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ખેડૂતોને ભલામણ આપવામાં આવે છે કે મગફળીના થડના સડાના નિયંત્રણ માટે ટ્રાયકોડમની માવજત દર વર્ષે આપવી.

(પ્રાધ્યાપક અને વડા, રોગશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(ઘ) મગફળીમાં થડ અને ડોડવાના સડાનું અસરકારક નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, મગફળીના થડ અને ડોડવાના સડાના અસરકારક નિયંત્રણ માટે ૧.૨૫ કિ.ગ્રા. ટ્રાયકોડમા હારજીયાનમ ૨ × ૧૦^५ જીવંત કોષો/ગ્રા. ને ૧૨૫ કિ.ગ્રા. દિવેલીના ખોળમાં બેળવી વાવેતર સમયે ચાસમાં આપવું અને તેટલો જ જથ્થો વાવેતરના એક મહિના પછી થડની પાસે વેરીને આપવો.

(પ્રાધ્યાપક અને વડા, રોગશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(ઇ) મગફળીના બીજમાં રોગ/જીવાતના નિયંત્રણ માટે માવજત

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે મગફળીમાં બીજ અને જમીનજન્ય રોગો/ ચૂસીયાં પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે બીજ માવજત તરીકે વપરાતા કૃષિ રસાયણો જેવા કે કાર્બનનાર્જીમ ૧૨% + મેન્કોઝેબ ૫૩% - ૭૫ વેપા ૩.૦ ગ્રામ/કિલો બીજ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૪.૦ ગ્રામ/કિલો બીજ અથવા કાર્બોક્સીન ૩૭.૫% + થાયરમ ૩૭.૫% - ૭૫ વેપા ૩.૦ ગ્રામ/કિલો બીજ અથવન ટેબ્યુકોનાઝોલ ૨ ડિએસ ૨.૦ ગ્રામ/કિલો બીજ અથવા ઈમીડાકલોપ્રીડ ૫૦૦ એફએસ ૩.૦ મિ.લિ./કિલો બીજના દરે આપેલ માવજતથી જમીનમાંની ટ્રાયકોડમની સંખ્યા ઘટતી નથી, આમ આ કૃષિ રસાયણો ટ્રાયકોડમા હારજીયાનમની સાથે સુસંગત છે.

(પ્રાધ્યાપક અને વડા, રોગશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(ઇ) મગફળીમાં વાનસ્પતિક વૃદ્ધિ અટકાવવા અને વધુ ઉત્પાદન માટે દ્રાવણનો છંટકાવ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-આબોહવાકીય વિસ્તારના ચોમાસુ મગફળી ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે વધુ પડતી વાનસ્પતિક વૃદ્ધિ અટકાવવા તથા વધુ ઉત્પાદન અને ચોમખી આવક મેળવવા માટે વાવણી બાદ ૩૦

દિવસે ૧૦૦૦ પી.પી.એમ. (૨ મિલીલિટર પ્રતિ લિટર) સાઈડકોસીલ (૫૦% એસ.એલ.) અથવા ૮૦ દિવસે ૫૦૦ પી.પી.એમ. (૨.૫ મિલીલિટર પ્રતિ લિટર) પેકલોબ્યુટ્રાઇલ (૨૩% ડબલ્યુ/ડબલ્યુ એસ.સી.) ના દ્રાવણનો છંટકાવ કરવો.
(સંશોધન વૈજ્ઞાનિક (મગફળી) મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જૂનાગઢ)

૩.૨ દિવેલા

(ક) દિવેલાના પાકમાં ખાતર વ્યવસ્થાપન

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં દિવેલાં ઉગાડતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે વાવેતર સમયે પ્રતિ હેક્ટરે ૪૦ કિ.ગ્રા. ફોર્સફરસ અને ૫૦ ગ્રામ બીજ દીઠ ત૦ ગ્રામ ફોર્સફેટ સોલ્યુબીલાઈઝિંગ માઈકો ઓર્ગનિકમ (કીટમીયમ ગલોબોઝમ)ની બીજ માવજત આપવાની સાથે ભલામણ કરવામાં આવેલ નાઈટ્રોજન (૧૨૦ કિ.ગ્રા./હે.) આપવાથી દાણાનું વધુ ઉત્પાદન અને નકો મળે છે.

(સંશોધન વૈજ્ઞાનિક (મગફળી) મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જૂનાગઢ)

(ખ) દિવેલા જીસી-૩ જાતમાં ખારા પાણીમાં ખાતરનું સંકલિત વ્યવસ્થાપન

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખારા પાણીથી દિવેલાં ઉગાડતા ખેડૂતોને જીસી-૩ જાત વાવવાની તથા ભલામણ કરેલ રાસાયણિક ખાતર સાથે પ્રતિ હેક્ટર છાણિયું ખાતર ૧૦ ટન અને જીપ્સમ તેની જરૂરીયાતના ૫૦ ટકા (૩ ટન/હે) પ્રમાણે આપવાની ભલામણ કરવામાં આવે છે.

(પ્રાધ્યાપક અને વડા, કૃષિ રાસાયણશાસ્ત્ર અને જમીન વિજ્ઞાન, જૂક્કુયુ, જૂનાગઢ)

૩.૩ તલ

(ક) તલના પાકમાં વધુ ઉત્પાદન માટે ઈન્ડોલ એસેટીક એસીડનો છંટકાવ

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તાર (ખેત આબોહવાકીય પરિસ્થિતિ-૫)માં ખરીફ ઋતુમાં તલનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે તલના પાકમાં ઈન્ડોલ એસેટીક એસીડ (આઈ.એ.એ.) ૧ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં (૧૦૦ પી.પી.એમ.ના) દ્રાવણનો કૂલ આવવાની અવસ્થાએ છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન અને ચોખ્ખી આવક મેળવી શકાય છે.

(સંશોધન વૈજ્ઞાનિક (સૂકી ખેતી) મુખ્ય સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, તરઘડીયા)

૪. કઠોળ પાકો

૪.૧ અડદમાં

(ક) અડદમાં નફો અને અસરકારક નીદણ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસુ અડદનું વાવેતર કરતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે અડદનું મહત્વમાં ઉત્પાદન, નફો અને અસરકારક નીદણ નિયંત્રણ માટે કવીજાળોફોપ-ઈથાઇલ ૪૦ ગ્રામ/હે (૫ હસી ૧ મ્બિ. લિ./૧૦ લિ. પાણી) પ્રમાણે વાવણી બાદ ૨૦ દિવસે છંટકાવ કરવો તથા વાવણી બાદ ૪૦ દિવસે હાથ નિંદામણ કરવું.

(સંશોધન વૈજ્ઞાનિક (ચણા) કઠોળ સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જૂનાગઢ)

(ખ) અડદમાં ઈયણોનું અસરકારક ને અર્થક્ષમ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને અડદનાં પાકમાં શિંગ કોરી ખાનારી ઈયણોનાં અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૦.૦૫% (૩ મિ. લિ. / ૧૦ લિટર પાણીમાં) અથવા ફલુબેન્ડીયામાઈડ ૪૮ એસસી ૦.૦૦૮૮ % (૨ મિ. લિ. / ૧૦ લિટર પાણીમાં) નાં બે છંટકાવ કરવાની ભલામણ છે. પ્રથમ છંટકાવ ૫૦ % ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ બાદ ૧૫ દિવસે કરવો.

કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસીના છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૨૦ દિવસનો જાળવવો અને ફલુબેન્ડીયામાઈડ ૪૮ છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૧૧ દિવસનો જાળવવો.

(સંશોધન વૈજ્ઞાનિક (ચણા) કઠોળ સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જૂનાગઢ)

૪.૨ ચણા

(ક) ચણાના વધુ ઉત્પાદન અને વધુ આવક માટે પોટેશિયમ નાઈટ્રોટનો છંટકાવ

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તાર (ખેત આબોહવાકીય પરિસ્થિતિ –૮)માં રવિ ઋતુમાં ચણા (ગુજ. જૂનાગઢ ચણા–૩)નું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, ચણામાં બે પિયત (પ્રથમ ફૂલ આવવાના સમયે અને બીજુ પોપટાના વિકાસના તબક્કે) આપવાની સાથે

પોટેશિયમ નાઈટ્રોટ ૨% દ્રાવજના બે છંટકાવ (પ્રથમ કૂલ આપવાના અને બીજુ પોપટાના વિકાસના સમયે) કરવાથી વધુ ઉત્પાદન અને વધુ ચોખ્યી આવક મેળવી શકાય છે.

(સંશોધન વૈજ્ઞાનિક (સૂકી ખેતી) મુખ્ય સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, તરઘડીયા)

૫. રોકડીયા પાકો

૫.૧ કપાસ

(ક) પિયત બીટી કપાસમાં નીદળા નાશક દવાઓની ચકાસણી

દક્ષિણ સૌરાખ્ય ખેત આબોહવાકીય વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર કરતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે કપાસનું મહત્વમાં ઉત્પાદન, ચોખ્યુ વળતર અને અસરકારક નીદળા નિયંત્રણ માટે પેન્ડીમેથાલીન ૮૦૦ ગ્રામ/ઝ. (૩૦ ઈસી ૬૦ મિ.લિ/૧૦ લિ.) પ્રમાણે વાવણી બાદ પરંતુ પાક અને નીદળા ઉગ્યા પહેલાં છંટકાવ કરવો તથા વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે હાથ નિંદામણ અને આંતરખેડ કરવા અથવા પેન્ડીમેથાલીન ૮૦૦ ગ્રામ/ઝ. (૩૦ ઈસી ૬૦ મિ.લિ/૧૦ લિ.) પ્રમાણે વાવણી બાદ પરંતુ પાક અને નીદળા ઉગ્યા પહેલાં છંટકાવ કરવો તથા વાવણી બાદ ૪૫ દિવસે કવીજાલોફોપ ૪૦ ગ્રામ/ઝ. (૫ ઈસી ૧૫ મિ.લિ/૧૦ લિ.) પ્રમાણે છંટકાવ કરવો.

(પ્રાધ્યાપક અને વડા, કૃષિ વિજ્ઞાન વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

૫.૨ શેરડી

(ક) શેરડી પાકમાં પિયત વ્યવસ્થાપન

દક્ષિણ સૌરાખ્ય ખેત આબોહવાકીય વિસ્તારમાં શેરડીનું વાવેતર કરતાં ખેડૂતોને વધારે ઉત્પાદન અને નફો મેળવવા માટે ટપક પદ્ધતિથી પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે. આ માટે શેરડીની રોપણી જોડિયા હાર પદ્ધતિમાં (૬૦ : ૬૦ : ૬૦ સેમી.) કરવી અને દરેક જોડિયા હાર વચ્ચે લેટરલ ગોડવી પાકને ૦.૮ બાળ્યિભવનાંકે પિયત આપતું. ટપક પદ્ધતિમાં ભલામણ કરેલ નાઈટ્રોજન અને પોટાશ ખાતરનો ૮૦ ટકા જથ્થો (એટલે કે ૨૦૦-૧૦૦ ક્રિ.ગ્રા. ના-પો / હે.) રોપણીના ૪૫ દિવસથી ચાલુ કરી ૨૦ દિવસના ગાળે ૧૦ સરખા હપ્તામાં આપવો.

૨૫ક પદ્ધતિની વિગત :

વિગત	પરિચાલનનો સમય— એકાંતરા દિવસે	
	મહિનો	મીનીટ
૨૫કલિયાનું અંતર : ૬૦ સે.મી.	માર્ય-મે	૨ કલાક ૨૦ મીનીટ
૨૫કલિયાની સ્વાવ ક્ષમતા: ૪ લીટર પ્રતિ કલાક	જૂન	૨ કલાક ૧૦ મીનીટ
પરિચાલનનું દબાણઃ ૧.૨ ક્રિ.ગ્રા. પ્રતિ ચો. સે.મી.	જુલાઈ—સપ્ટેમ્બર	૧ કલાક ૩૦ મીનીટ
પરિચાલનની પુનરાવૃત્તિ: એકાંતરા દિવસે	આક્ટોબર—નવેમ્બર	૧ કલાક ૪૦ મીનીટ
	ડિસેમ્બર—જાન્યુઆરી	૧ કલાક ૨૫ મીનીટ

(સંશોધન વૈજ્ઞાનિક (શેરડી) મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર, જૂકૂયુ, કોડીનાર)

૬. શાકભાજી પાકો

૬.૧ લસણા

(ક) લસણમાં નીદણ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં લસણનું વાવેતર કરતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે લસણનું મહત્તમ ઉત્પાદન, ચોખ્યુ વળતર અને અસરકારક નીદણ નિયંત્રણ માટે ઓક્સિફ્લોરફેન ૨૪૦ ગ્રામ/લે. (૨૩.૫ ઈસી ૨૦ મિ.લિ./૧૦ લિ.) પ્રમાણે વાવણી બાદ પરંતુ પાક અને નીદણ ઉગ્યા પહેલાં છંટકાવ કરવો તથા વાવણી બાદ ૪૦ દિવસે હાથ નિંદામણ કરવું અથવા ઓક્ઝાડાયાર્જિલ ૮૦ ગ્રામ/લે. (૫ ઈસી ૩૦ મિ.લિ./૧૦ લિ.) પ્રમાણે વાવણી બાદ પરંતુ પાક અને નીદણ ઉગ્યા પહેલાં છંટકાવ કરવો તથા વાવણી બાદ ૪૦ દિવસે હાથ નિંદામણ કરવું.

(પ્રાધ્યાપક અને વડા, કૃષિ વિજ્ઞાન વિભાગ, જૂકૂયુ, જૂનાગઢ)

(ખ) લસણમાં કારી જમીનમાં રાસાયણિક ખાતરનું વ્યવસ્થાપન

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના કારમય જમીનમાં લસણ વાવતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે લસણનું વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે ભલામણ કરેલ રાસાયણિક ખાતરના ૫૦ % (૨૫—૨૫—૨૫ ક્રિ.ગ્રા. ના.—ફો.—પો./લે.) જથ્થા સાથે ૧૦ ટન છાણિયું ખાતર પ્રતિ હેક્ટારે આપવું.

(પ્રાધ્યાપક અને વડા, કૃષિ રસાયણશાસ્ત્ર અને જમીન વિજ્ઞાન, જૂકૂયુ, જૂનાગઢ)

૬.૨ રીગણા

(ક) રીગણામાં સફેદ માખીનું અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં રીગણાની સફેદ માખીનાં અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ્સી, ૦.૦૦૨%, ૧.૦૮ મિ.લિ./૧૦ લિટર પાણીના ત્રણ છંટકાવ દર ૧૫ દિવસના અંતરે કરવાની ભલામણ કરવામાં આવે છે. કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ્સી, ૦.૦૦૨%ના છંટકાવ અને ફળ ઉત્તારવા વચ્ચે સમયગાળો એક દિવસ રાખવો.

(પ્રાધ્યાપક અને વડા, કિટક શાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

૬.૩ ટામેટાં

(ક) ટામેટાંમાં ભાસ્મીક જમીનમાં ખાતરનું સંકલિત વ્યવસ્થાપન

આથી દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ભાસ્મીક જમીન (ઈસી ૧.૪૮ ડે.સા./મી. પી.એચ. ૭.૮૧, ઈએસપી ૨૧.૮૪%) અને ભાંખરા પાણીમાં (ઈસી ૪.૩૪ થી ૪.૮૮ ડે.સા./મી.) શિયાળુ ટામેટાં (જેટી-૩) ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે છાણીયું ખાતર ૫ ટન/ઝે. સાથે ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો ૫૦% જથ્થો (૩૭.૫ + ૧૮.૭૫ + ૩૧.૨૫ ના.ફો. પો. કિ.ગ્રા./ઝે.) તેમજ મરધાની ચરક ૩૭૦૦ કિ.ગ્રા./ઝે આપવાથી વધારે ઉત્પાદન અને ચોખ્ખો નફો મળે છે.

(સંશોધન વૈજ્ઞાનિક(ફળપાકો), કૃષિ સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, મહુવા)

૭. મસાલા પાકો

૭.૧ જીરુ

(ક) જીરુમાં નીદણ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં જીરુનું વાવેતર કરતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે જીરુનું મહત્તમ ઉત્પાદન, ચોખ્ખુ વળતર અને અસરકારક નીદણ નિયંત્રણ માટે ઓક્સાડાયાર્જીલ ૭૫ ગ્રામ/ઝે. (૬ ઈસી ૨૫ મિ.લિ./૧૦ લિ.) પ્રમાણે વાવણી બાદ ૭ દિવસે છંટકાવ કરવો તથા વાવણી બાદ ૪૫ દિવસે હાથ નિંદામણ કરવું.

(પ્રાધ્યાપક અને વડા, કૃષિ વિજ્ઞાન વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(અ) જીરુમાં સુકારાના અસરકારક નિયંત્રણ

દક્ષિણ સૌરાખ્ય ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, જીરુના સુકારાના અસરકારક નિયંત્રણ માટે ૫.૦ કિ.ગ્રા. ટ્રાયકોડમાં હારજીયાનમ 2×10^5 જીવંત કોષો/ગ્રા. ને ૧૦૦૦ કિ.ગ્રા./હે. ગળતીયા ખાતરમાં ખેળવી વાવણી સમયે જમીનમાં આપવું.

(પ્રાધ્યાપક અને વડા, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(ગ) જીરુમાં સુકારાના રોગ માટે સંકલિત રોગ વ્યવસ્થાપન

દક્ષિણ સૌરાખ્ય ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, જીરુના સુકારાના અસરકારક નિયંત્રણ માટે ૧.૭૦ કિ.ગ્રા. ટ્રાયકોડમાં વિરીડી + ૧.૭૦ કિ.ગ્રા. ટ્રાયકોડમાં હારજીયાનમ + ૧.૭૦ કિ.ગ્રા. સ્યુડોમોનાસ ફલુરેસન્સ (2×10^5 જીવંત કોષો/ગ્રા.) અથવા ૨.૫ કિ.ગ્રા. ટ્રાયકોડમાં વિરીડી + ૨.૫ કિ.ગ્રા. સ્યુડોમોનાસ ફલુરેસન્સ (2×10^5 જીવંત કોષો/ગ્રા.)ના મિશ્રણને ૫૦૦ કિ.ગ્રા. દિવેલીના ખોળમાં ખેળવી વાવેતર સમયે જમીનમાં વેરીને આપવું.

(પ્રાધ્યાપક અને વડા, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(ઘ) જીરુમાં સુકારાના નિયંત્રણ માટે ટ્રાયકોડમાં હારજીયાનમ અને દિવેલીના ખોળની માવજત

દક્ષિણ સૌરાખ્ય ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, જીરુના સુકારાના અસરકારક નિયંત્રણ માટે ટ્રાયકોડમાં હારજીયાનમ (2×10^5 જીવંત કોષો/ગ્રા.) ૫ કિ.ગ્રા. ને ૫૦૦ કિ.ગ્રા. દિવેલીના ખોળમાં ખેળવી વાવેતર સમયે જમીનમાં આપવું તેમજ ૫ કિ.ગ્રા./હે. ને ૧૦૦ કિ.ગ્રા. રેતીમાં ખેળવી પાકના ઉગાવાના એક મહિના પછી વેરીને આપવું.

(પ્રાધ્યાપક અને વડા, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(ચ) જીરુમાં નીદણ નિયંત્રકમાં ટ્રાયકોડમા હારજીયાનમની અસર

દક્ષિણ સૈરાખ્રુ ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, ટ્રાયકોડમા હારજીયાનમ જમીનમાં બેળવ્યા બાદ જીરુમાં નીદણ નિયંત્રણ માટે વપરાતુ નીદણનાશક, ઓક્સાડાયાર્જીલ ફ ઈસી, ૦.૦૭૫ કિલો સ.ત./હે. (૨૫ મિ.લિ./૧૦ લિટર)ના દરે વાવેતરના સાત દિવસ પછી આપવાથી જમીનમાંની ટ્રાયકોડમાની સંખ્યામાં ઘટાડો થતો નથી.

(પ્રાધ્યાપક અને વડા, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

૮. બાગાયતી પાકો

૮.૧ આંબા

(ક) આંબામાં ટપક પિયત પદ્ધતિથી જીવાતોનું નિયંત્રણ

દક્ષિણ સૈરાખ્રુ ખેત આબોહવાકીય વિસ્તારમાં આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને જણાવવામાં આવે છે કે, ટપક પિયત પદ્ધતિમાં ગાંઠીયા માખી, મધિયો અને શ્રીપસનો ઉપદ્રવ રેલાવીને પિયત પદ્ધતિ કરતા ઓછો જોવા મળે છે.

(પ્રાધ્યાપક અને વડા, કિટકશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

૮.૨ પપૈયા

(ક) પપૈયામાં ખાતરનું સંકલિત વ્યવસ્થાપન

દક્ષિણ સૈરાખ્રુ ખેત આબોહવાકીય વિસ્તારના પપૈયા જાત મધુબિંદુ ઉગાડતા ખેડૂતોને આથી ભલામણ કરવામાં આવે છે કે પપૈયાના પાકમાં ૨૫% નાઈટ્રોજન છાણીયા ખાતરમાંથી (૬ કિ.ગ્રા. છાણીયું ખાતર) અને બાકીનો ૭૫% નાઈટ્રોજન (૧૫૦ ગ્રામ નાઈટ્રોજન) ૨૦૦ ગ્રામ ફોસ્ફરસ તેમજ ૨૫૦ ગ્રામ પોટાશ પ્રતિ છોડ દીઠ રાસાયણિક ખાતર ફેર રોપણી બાદ બીજા, ત્રીજા અને ચોથા મહિને એક્સરખા હપ્તામાં આપવાથી વધુ ઉત્પાદન અને ચોખ્યો નફો મળે છે.

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(ખ) પપૈયામાં વધુ ઉત્પાદન માટે સૂક્ષ્મ તત્વોનો છંટકાવ

દક્ષિણ સૈરાખ્રુ ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને આથી

ભલામણ કરવામાં આવે છે કે પણેયા જાત મધુબીદુ સુક્ષ્મ તત્ત્વોમાં જીક સલ્ફેટ ૨૪.૦ ગ્રામ (જીક ૦.૫%) અને બોરોક્સ ૧૦.૦ ગ્રામ (બોરોન ૦.૧%) પ્રતિ લીટરે મુજબ ફેર રોપણીના બીજા અને ચોથા મહીને છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન અને આવક મળે છે.

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂક્ક્યુ, જૂનાગઢ)

૮.૩ ચીકુ

(ક) ચીકુમાં સોલાર ડ્રાઇર દ્રારા સૂક્કવણી સંગ્રહ

ફળોની બનાવટોના ઉત્પાદકોને ભલામણ કરવામાં આવે છે કે ચીકુની ૦.૫ સે.મી. જાડાઈની સ્લાઈસને સોલાર ડ્રાઇર દ્રારા ઉત્તે રીકવરી મળે ત્યાં સુધી સુક્કવણી સંગ્રહ કરવાથી તું માસ સુધી સારી ગુણવત્તા જળવાઈ રહે છે.

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂક્ક્યુ, જૂનાગઢ)

૯. કૃષિ ઈજનેરી

(ક) બી.ટી. કપાસમાં ટપક પિયત પદ્ધતિ અને મલ્લીગની ઉત્પાદકતા

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, બી.ટી. કપાસના વાવેતરમાં ટપક પિયત પદ્ધતિ (બે લેટરલ વચ્ચેનું અંતર : ૧.૨ મી., ડ્રીપર વચ્ચેનું અંતર : ૪૦ સે.મી., ડ્રીપર ડીસ્કાર્જ: ૨ લીટર/ કલાક) સાથે બેડ બનાવી તેના ઉપર ૨૦ માઈક્રોનનું સિલ્વર કાળું પ્લાસ્ટિક પાથરી તેને એકાંતરે દિવસે ૦.૮ ઈટીસી લેવલે (અથવા સપેન્ભર- ઓક્ટોબર માસમાં ૨-૩.૫ કલાક, નવેન્ભર-ડિસેન્ભર માસમાં ૨.૨૫-૩.૨ કલાક અને જાન્યુઆરી માસમાં ૧.૨૫-૩ કલાક) ચલાવવાથી મલ્લીગ વગરના કપાસની સરખામણીમાં વધુ ઉત્પાદન (૩૭%), પાણી વપરાશની કર્યક્ષમતા (૭૮%) તથા પાણીની ઉત્પાદકતા (૮૧%) તેમજ વધારે આવક મેળવી શકાય છે.

(સંશોધન વૈજ્ઞાનિક (કૃષિ ઈજનેરી), આરટીટીસી વિભાગ, જૂક્ક્યુ, જૂનાગઢ)

(ખ) કેરીના પોસેસીગમાં કેટાયન એક્ષચેન્જ રેઝનાં માદ્યમ દ્રારા પેક્ટીનનું વધુ ઉત્પાદન

કેરીનું પોસેસીગ કરતા પોસેસરોને કેરીની છાલમાંથી પેક્ટીન મેળવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્રારા વિકસાવવામાં આવેલ પદ્ધતિથી, કેટાયન

એક્ષચેન્જ રેઝીનનો એક્સટ્રેક્શન માધ્યમ તરીકે ઉપયોગ કરી, છાલ તથા નિર્જર્ખણ માધ્યમનું પ્રમાણ ૧:૪, પી.એચ. અંક ૨.૫૬ અને નિર્જર્ખણ પ્રક્રિયા દરમાનનું તાપમાન 80° સે. જાળવી ૫૦ મિનીટ સુધી બે વખત આ પ્રક્રિયા કરવાની ભલામણ કરવામાં આવે છે. આ પદ્ધતિથી સારી ગુણવત્તા ધરાવતા પેક્ટીનનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે, જેમાં લાભ અને ખર્ચનો ગુણોત્તર ૧.૧૭ મળે છે.

(પ્રાધ્યાપક અને વડા, પ્રોસેસીંગ અને ફૂડ એન્જી. વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(ગ) ગ્રીન હાઉસ/ નેટ હાઉસમાં કોર્ટ ગ્રીન હાઉસ ફિટ્ટિંગેશન સીસ્ટમનો ઉપયોગ

ગ્રીનહાઉસ/નેટહાઉસ આધારીત ખેતી કરતા ખેડૂતોને ટપક પદ્ધતિથી ખાતર આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ લો કોર્ટ ગ્રીનહાઉસ ફિટ્ટિંગેશન સીસ્ટમ નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

(પ્રાધ્યાપક અને વડા, રીન્યુઅભલ એનજી અને દૂરલ એન્જીયરીંગ વિભાગ,
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂક્કુયુ, જૂનાગઢ)

(ઘ) સીમલા મીર્ચમાં શેડવાળા નેટ હાઉસથી રોગ/ જીવાતનું નિયંત્રણ અને વધુ ઉત્પાદન

દક્ષિણ સૌરાખ્ય ખેત આબોહવાકીય વિસ્તારનાં કેપ્સીકમ (શીમલા મીર્ચ) ઉગાડતા ખેડૂતોને સફેદ કલરના ૫૦% શેડવાળા નેટહાઉસ વાપરવાની ભલામણ કરવામાં આવે છે, રોગ—જીવાતથી પાકનું રક્ષણ થાય છે તેમજ લીલા, કાળા અને ભૂરા કલરનાં નેટહાઉસ કરતા વધુ ઉત્પાદકતા મેળવી શકાય છે.

(પ્રાધ્યાપક અને વડા, રીન્યુઅભલ એનજી અને દૂરલ એન્જીયરીંગ વિભાગ,
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂક્કુયુ, જૂનાગઢ)

(ય) તરબૂચમાં વધુ ઉત્પાદન માટે મલ્ય અને ટપક પિયત પદ્ધતિ

દક્ષિણ સૌરાખ્ય ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ઉનાળું ઋસુ
દરમાન તરબૂચના પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે ૨૦ માઈક્રોન જાડાઈવાળું
સીલવર બ્લેક કલરની પ્લાસ્ટિક મલ્યનો ઉપયોગ કરી અને ૦.૫ ઈટીસી લેવલે
ટપક પદ્ધતિ દ્વારા પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે.

બેડ અને પ્લાસ્ટીક મલ્ય અંગેની માહિતી :		ટપક પદ્ધતિ અંગેની માહિતી :	
૧	પ્લાસ્ટીક કિલ્મ : ૨૦ માઈક્રોન સીલવર બ્લેક ક્લર	૧	લેટરલનું અંતર : ૧૮૦ સે.મી.
૨	બેડનું માપ : અ. ઉપરની પણોળાઈ : ૪૫ સે.મી. બ. નીચેની પણોળાઈ : ૭૦ સે.મી. ક. ઊચાઈ : ૩૦ સે.મી.	૨	શીપરનું અંતર : ૪૦ સે.મી.
૩	પ્રતી બેડલારીની સંખ્યા : ૨	૩	શીપર ડિસ્ચાર્જ રેટ : ૨ લીટર/કલાક શીપ ચલાવવાનો સમય : ઇન્ઝ્યુઆરી : ૨૦ થી ૪૫ મિનીટ/દિવસ માર્કે : ૩૦ થી ૮૫ મિનીટ/દિવસ
૪	અંતર : અ. બેડનું અંતર : ૧૮૦ સે.મી. બ. બેં હાર વચ્ચેનું અંતર : ૨૦ સે.મી. ક. બેં છોડ વચ્ચેનું અંતર : ૪૦ સે.મી.	૪	એપ્રિલઃ ૭૦ થી ૧૦૫ મિનીટ/દિવસ મેઃ ૭૦ થી ૮૦ મિનીટ/દિવસ

(પ્રાધ્યાપક અને વડા, ગીન્યુન્યોલેલ અને રૂરલ એન્જીયરીંગ વિભાગ, કૃષી ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જૂક્કુય, જૂનાગઢ)

૧૦. મત્સ્ય પાલન

(ક) માછલીની સમજણ પૂર્વક માછીમારી કરવાની ભલામણ

વેરાવળનાં માછીમારોને જાણ કરવામાં આવે છે કે સોલ્જર કેટ છીશ (ગોજી) પ્રજાતિની વધુ પડતી માછીમારી કરવાથી ભવિષ્યમાં તેની સંખ્યામાં ઘટાડો થશે. આથી આ માછલીની સમજણપૂર્વકની માછીમારી કરવા ભલામણ કરવામાં આવે છે.

(પ્રાધ્યાપક અને વડા, એફ.આર.એમ. વિભાગ, ફિશરીઝ કોલેજ, જૂક્કુય, વેરાવળ)

(ખ) રાણી ફીશની ગુણવત્તા માટે યોગ્ય તાપમાને સંગ્રહ

સુરમી બનાવતાં મત્સ્ય પ્રક્રિયાકારો અને નિકાસકારોને ભલામણ કરવામાં આવે છે કે તે રાણી ફીશની સુરમીને -18° સે. તાપમાને સંગ્રહ કરવા માટે રૂઢીગત વપરાતા કાયોપ્રોટેકટન્ટના બદલે કુદરતી કાયોપ્રોટેકટન્ટ તરીકે ૧% શ્રીભ્ય (ઝીગા) કાયટોસનનો ઉપયોગ કરવાથી રાણી ફીશની સુરમીની ગુણવત્તા, પાણી સંગ્રહ ક્ષમતા અને સિથિતિસ્થાપકતા (જેલ સ્ટ્રેન્થ) ૨૪૦ દિવસો સુધી સારી રીતે જાળવી શકાય છે.

(પા. અને વડા, હાર્સેસ્ટ અને પોસ્ટ હાર્સેસ્ટ વિભાગ, ફિશરીઝ કોલેજ, જૂક્કુય, વેરાવળ)

(ગ) ખારાશવાળા પાણીમાં ગૂર્ધિઓ તથા માઈસીસનો ઉછેર

હેચરી ઉદ્ઘોગ સાહસિકોને ભલામણ કરવામાં આવે છે કે પીનીયસ મોનોડોનના લાર્વના (ગૂર્ધિઓ તથા માઈસીસ) ઉછેર માટે ૧૫ પાર્ટ્સ પર થાઉઝન્ડ (પીપીટી) તથા પોસ્ટ લાર્વલ (પી.એલ.-૧ થી પી.એલ.-૨૦) ઉછેર માટે ૨૦ પાર્ટ્સ પર થાઉઝન્ડ (પીપીટી) ખારાશવાળું પાણી વાપરવાથી વધુ જીવંત દર મળે છે.

(સંશોધન અધિકારી, ફિશરીઝ સંશોધન કેન્દ્ર, જૂક્કુય,

(ક) ખેતી પાકોમાં જીવાતો દ્વારા જૈવિક નિયંત્રણ

ખેડૂતોને સલાહ આવામાં આવે છે કે, ખેતરમાંથી એકનિત કરેલા પુષ્ટ પરભક્તી લાલ દાળિયાને ગડી પાડેલ કાગળ ઘરાવતી બરણીમાં રાખી તેને ફીજમાં (૮.૦ થી ૭.૫° સે.) ૧૨૦ દિવસ સુધી ૮૪% જીવંત દર સાથે, તેની આપુષ્ટ અને પ્રજનન શક્તિને કોઈપણ જીતનાં અવરોધ વગર શીત સંગ્રહ કરી શકાય છે અને તેનો ખેતી પાકોની જીવાતોના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

(પ્રાધ્યાપક અને વડા, કિટક શાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(ખ) લીલી ઈયળ અને લશકરી ઈયળ જીવાતનું જૈવિક નિયંત્રણ

લીલી ઈયળ તથા લશકરી ઈયળોના જૈવિક નિયંત્રણમાં રસ ઘરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, વિખાણુ રોગબ્રસ્ત ઈયળોને ઘરાઉ રેફીજરેટરમાં (૮.૦ થી ૭.૫° સે.) ૮ માસ સુધી ૧૦૦% રોગ ઉત્પન્ન કરવાની ક્ષમતા સાથે સંગ્રહ કરી શકાય છે. જેનો સંબંધિત જીવાતનાં જૈવિક નિયંત્રણ માટે વિખાણુયુક્ત દ્રાવક તૈયાર કરી ઉપયોગમાં લઈ શકાય છે.

(પ્રાધ્યાપક અને વડા, કિટક શાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(ગ) મશરૂમમાં વધુ ઉત્પાદન માટે બીજનો દર જાળવવો

મશરૂમ ઉગાડતા ઉદ્ઘર્ભીઓને ભલામણ કરવામાં આવે છે કે, પ્લાસ્ટિકની કોથળી (18×24 ઈચ્ચ)માં ઉગાડતી ઓફ્સટર મશરૂમના અધિક જૈવિક કાર્યક્ષમતા સાથે વધુ ઉત્પાદન માટે ૩% નો બીજનો દર રાખવો.

(પ્રાધ્યાપક અને વડા, રોગ શાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

(ધ) મશરૂમમાં મહત્તમ જૈવિક કાર્યક્ષમતા માટે ઘઉના પરાળનું માધ્યમ

મશરૂમ ઉગાડતા ઉદ્ઘર્ભીઓને ભલામણ કરવામાં આવે છે કે, પ્લાસ્ટિકની કોથળી (18×24 ઈચ્ચ)માં ઉગાડતી ઓફ્સટર મશરૂમના મહત્તમ જૈવિક કાર્યક્ષમતા સાથે વધુ ઉત્પાદન માટે કોથળી દિઠ ત કિલો ઘઉના પરાળના માધ્યમનો ૩%ના બીજ દર સાથે ઉપયોગ કરવો.


(પ્રાધ્યાપક અને વડા, રોગ શાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)



મગફળી + કપાસ આંતરપાક પદ્ધતિ



કપાસમાં મલ્યોગ અને
ટપક પદ્ધતિ



જડમાં રાસાયણીક
અને હાથથી નોંધણા નિયંત્રણ



પી-નીયસ મૌનોરીન
(ટાઈગર જુંગો)



युनिवर्सिटी भवन,
जूनागढ़ कृषि युनिवर्सिटी, जूनागढ़



सर्वदार स्मृति केन्द्र
जूनागढ़ कृषि युनिवर्सिटी, जूनागढ़